https://archive.org/details/bk830/page/n0/mode/1up

1936-12-21 -Pirana Satpanth Patidar Gnati Bhaione Vinanti Patra (830)

All Items on https://archive.org/details/realpatidar

પીરાણા સતપંથી પાટીદાર જ્ઞાતિ ભાઇઓને

realpatidar.com

વિનંતી પત્ર.

Full Library on https://realpatidar.com/library

…ય જ્ઞાતિના વડીલો, ભાઇઓ, માતાઓ અને બહેનોની પવિત્ર સેવામાં.

કરાચીથી લીખતંગ અમો ઉગમણા પાચાડાના કેટલાક પાટીદાર ભાઇઓના સવિનય ઘટીત વાંચશો.

…વિ. વિ. સાથે જ્ઞાતિના સમસ્ત નાના મોટા ભાઇઓ પાસે અમારી …ર્ક અરજ છે કે, આપણા કચ્છ દેશમાં વરસાદના અભાવે કેટલાક વરસો દુકાળ જેવાં થવાથી ખેતીમાં પેદાશ પુરતી નહિ રહેવાથી આપણી જ્ઞાતિનાં અમો કેટલાક ભાઇઓ પરદેશમાં વસીએ છીએ; જ્યાં અમો રહીએ છીએ ત્યાં બીજી ઊંચ જ્ઞાતિના માણસો પણ રહે છે, તેઓ આપણા રીત રીવાજો કે જે આપણા કેટલાક ભાઇઓ મુડદાને દાટીએ છીએ તેના પાછળ ત્રીજે દીવસે જારતની ક્રિયા કરીએ તથા ત્રીયું (ત્રીજા દીવસે જમણ) પણ કરીએ છીએ, વળી તેની પાછળ દેવ વીગેર કરીએ છીએ તે જોઇને અમોને બહુ શરમાવે છે પણ અમો સતપથનો તથા નાતનો કાયદો લોપી શકતા નથી. તેથી સતપંથના રીત રીવાજો શામાટે કરવામાં આવે છે તેના ખુલાસા માટે **સૈયદ બાવા સાહેબ અહેમદઅલીને** મુખી કાનજી વિરજીના નામથી પચાસ પ્રશ્નોની એક ચોપડી છપાવીને પુછ્યા તેનો જવાબ અમોને સૈયદ બાવા સાહેબે એક કાગળીઆ છપાવીનેજ પતાવી દીધો છે. જે તમારી પાસે પણ આવ્યો હશે ને તમો વાંચ્યો હશે ન વાંચ્યો હોય તો તમો જરૂરથી વાંચી જોશો તો તમોને પણ ખાત્રી થશે કે તેણે જવાબો લખવામાં કેટલો પોતાના દંભ દેખાડયો છે, પોતે વિદ્વાન છે તથા આપણને અભણ અને ભોટ માની ન્યાયદર્શન તથા મનુસ્મૃતીના અધુરા શ્લોકો લખી પોતે ઋષિઓ અને મલેચ્છો બધાએના લક્ષણ એક સરખાં હોવા જોઇએ તેવુ બતાવી પોતાની વિદ્યાની કીમત કરાવી છે. વળી તે આગળ જતાં જે લખે છે તેનો મુળ ઉદેશ એજ છે કે, જ્યાંસુધી તમો હિન્દુ અને મુસલમાનનુ જુદાપણું જાણશો ત્યાંસુધી તમોને સતપંથ સમજવામાં નહિ આવે તેથી તમારે ને મારે ખાલી માથાકુટ કરવી નકામી છે.

પૂજ્ય વડીલો આવો જવાબ આપી સૈયદ બાવા સાહેબે તો ખરેખર અમો સતપંથીઓની હાંસીજ કરી છે પોતે વિદ્વાન છે તેમ પોતે પીરાણાના પીર ઇમામશાહની ઓલાદના હોવાનો દાવો કરે છે પણ અમોને 'તો આ કાગળીઆથી બીલકુલ તેની છળ પ્રપંચની નીતીજ દેખાય છે કારણ કે જુઓ ઇમામશાહના વંશના થઇને કેટલું ગોળમટોળ ન હિન્દુ કે ન મુસલમાન જેવું વર્તન કરી રહ્યા છે. પણ ઇમામશાહના વંશના તો સૈયદ પુંજામીયાં હુસેનમીયાં છે કે જે સત્યવક્તા નીડર અને બાહોસ વેપારી તરીકે પંકાય છે. તેમને જરાપણ પોતાના મતલબની પરવાહજ નથી પીરાણા સતપંથ હિન્દુ ધર્મ છે એવું ગુજરાતમાંથી ગામ માનકુવાના પટેલ લધા ખેતાએ એક હેન્ડબીલ તા. ૧-૨-૩૫ના રોજ છપાવીને સતપંથીઓને ભુલાવવાની કોશીશ કરી છે તેના જવાબમાં તા. ૨૪-૪-૩૫નાં રોજ એક ચોપાનીયું જે ફુલેશકેપ સાઇઝના ચાર પાના ભરીને છપાવ્યું છે તે ઘણુંજ લાંબુ અને ખુલાસાવાર છે પણ આ પત્રના લંબાણની બીકથી તેમાંથી ફક્ત એકજ પારેગ્રાફમાં જે મુદ્દાનું લખાણ છે તે આપ ભાઇઓની જાણ માટે અત્રે ઉતારવામાં આવ્યું છે. (વધારે જાણવું હોય તો પીરાણાના સૈયદ પુંજામીયાં પાસેથી મંગાવીને વાંચી જોશો) તે સાંભળો—

પાના બીજાની લીંટી-લાઇન ૨૯થી લખે છે કે :—

પીરાણાની દરગાહ અને તેના કમ્પાઉન્ડમાં કબ્રસ્થાન છે મોટી મસજીદો છે, ઇમામખાનું છે તેમ બીજી દરગાહો છે. તે શીવાય કોઇબી હીંદુધર્મનું મંદીર કે હીંદુઓનું કોઈ સ્થાન કે મુરતીઓ નથી. તે બધી દુનીયા આગળ મોજુદ છે પરન્તુ જે મુકરેલા છે તે ગમે તેમ કહે તેમાં કાંઈ વળે તેમ નથી વધારેમાં જો તમો સાચા હો તો હિન્દુસ્તાનમાં જે વખણાતા પંડીતો હોય તેમને બોલાવી અમદાવાદ અગર બીજે ઠેકાણે એક સભા કરીને હિન્દુ ધર્મ છે તેવું સાબીત કરી આપો તો તમને રૂ૦ ૫૦૦૧) રૂપીઆ પાંચ હજારને એકનું ઈનામ આપવામાં આવશે. જો તમો જાહેર ખબર છપાવનારા સાચા હશો તો તેમ કરવા ચુકશો તો તમે જુઠા ને તમારૂં પ્રપંચપણું સાબીત છે.

ઉપરના લખાણથી આપ જ્ઞાતિ વડીલોને વિચારવું જોઇએ કે તમો માંયલા કેટલાક ભગતના ઉપનામથી ઓળખાતા ભાઇઓ અમોને હમેશાં કહેતા ફરો છો કે અમો વિદ્વાન છીએ, ચારવેદને જાણીએ છીએ ગમે તેવા પંડીતો હોય તે અમારી પાસે આવે તોપણ આ પીરાણા સતપંથ હિન્દુ ધર્મ છે એવું અમો સાબીત કરી આપવા તઇયાર છીએ તો ભાઇઓ તમો મહેરબાની કરીને એવા વિદ્વાન ભાઇઓને સમજાવા સૈયદ પુંજામીયાં પાસે તેડી જઇ પીરાણા સતપંથ હિન્દુ ધર્મ છે એવું સાબીત કરાવી રૂપીઆ ૫૦૦૧) નું ઇનામ લઇને જાહેર જનતામાં છપાવી બહાર પાડશો કે જેથી અમો પરદેશ વસતા ભાઇઓને બીજી હિન્દુ જ્ઞાતિઓના મહેણાં ટોણાં ખાવા પડે છે તેથી બચીએ.

ભાઇઓ! હમણાંજ અમોને ગુજરાતમાંથી એક આપણી જ્ઞાતિના હિતચિંતક બન્ધુ તરફથી એક ચોપાનીયું મળ્યું છે જે તા. ૧૫-૧૧-૩૬ મહાલક્ષ્મી પ્રીન્ટરી કપડવંજમાં છપાવેલ છે તેમાં તેણે પીરાણા સતપંથના સંબંધમાં આપણને જાણવા જેવું ઘણુંજ સારૂ લખાણ કરેલું છે અને પીરાણાની ક્રિયાઓ અને પીરાણાની પૂજામાં વપરાતી પાવળની ગોળી કઇ કઇ ચીજમાંથી બનાવવામાં આવે છે તે તથા બીજી ઘણી ઉપયોગી બાબતોનો ખુલાસો કરેલો છે તે આપણા પીરાણા સતપંથી સર્વે ભાઇઓએ જરૂરથી વાંચવા જેવો છે તે મંગાવીને વાંચવાથી આપશ્રીઓને ચોખ્ખું દેખાશે કે આપણા સતપંથી ભાઇઓમાંથી કેટલાક ભાઇઓ રમજાન મહીનાના ત્રીસે ત્રીસ રોજા રાખે છે તેમજ મહોરમના દીવસે પણ જરૂર જેવી ક્રિયાઓ કરે છે અને આપણે બધા મુડદાંને દાટીએ છીએ તેની ત્રીજે દીવસે જારત તથા ત્રીયાનું જમણ પણ કરીએ તેના દેવ વીગેરે કરીએ છીએ સવાર સાંજે દોવાઓ જે બોલીએ છીએ તે પણ મુસલમાની રીત મુજબ કલમાઓવાળી હોય છે અને તેજ દુવાઓથી આપણા છોકરા છોકરીઓને પરણાવીએ છીએ વીગેરે બાબતો આપણે મુસલમાની રીતેજ કરીએ છીએ ને વળી આપણું કુળ અને જ્ઞાતિનું ભુષણ તપાસતાં કેટલાક ભાઇઓ હિન્દુઓના દરેક દેવ મંદિરમાં જાય છે શ્રાવણ મહીનામાં શ્રીકૃષ્ણની જન્માષ્ટમી તથા દીવાળી હોળી વીગેરે તહેવારો પણ પાળીએ છીએ તેથી હવે અમોને વિચાર થાય છે કે આપણે કચ્છના કણબી પીરાણા સતપંથીઓ છીએ. કોણ હિન્દુ કે મુસલમાન ?

આ ઉપરની હકીકત વાંચી સાંભળીને આપ જરૂર વિચાર કરશો અને અમારી ઇચ્છા પીરાણા ધર્મ હિન્દુ ધર્મ છે કે મુસલમાની પંથ છે તેનો ખુલાસો કરશો તે કરવામાં જો ઢીલ થશે તો હવે અમો પરદેશમાં વસતા ભાઇઓને તમામ અરચણ વધશે, આપ ભાઇઓ જરૂરથી જલદીથી ખુલાસો કરશો. પ્રભુ તેમ કરવાની તમોને હિમત અને બુદ્ધિ આપે કે જેથી જ્ઞાતિમાં સંપ અને સલાહ થાય. એજ ઇચ્છતા અમો છીએ,

ઠેકાણુ :—પટેલ ખેતશી પ્રેમજી
વોરા ઇબરામજી સુલેમાનજી કંમપાઉન્ડ નાં. ૪
રણછોડ લાઇન, નબીબક્ષ રોડ-કરાચી.
કરાચી, તા. ૨૧-૧૨-૩૬

તમારાજ

realpatidar.com

જ્ઞાતિ બંધુઓ.

દુર્ગા પ્રીન્ટીંગ પ્રેસ-કરાચી.

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk830/page/n1/mode/1up

Real Patidar
Unravel Truth

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v5.py

https://archive.org/details/bk830/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.19 16:23:48 +05'30'

Real Patidar
Unravel Truth

પીરાણા સતપંથી પાટીદાર જ્ઞાતિ ભાઇઓને

realpatidar.com

વિનંતી પત્ર.

પૂજ્ય જ્ઞાતિના વડીલો, ભાઇઓ, માતાઓ અને બહેનોની પવિત્ર સેવામાં.

કરાચીથી લીખતંગ અમો ઉગમણા પાચાડાના કેટલાક પાટીદાર ભાઇઓના સવિનય ઘટીત વાંચશો.

વિ. વિ. સાથે જ્ઞાતિના સમસ્ત નાના મોટા ભાઇઓ પાસે અમારી નમ્રતાપૂર્વક અરજ છે કે, આપણા કચ્છ દેશમાં વરસાદના અભાવે કેટલાક વરસો દુકાળ જેવાં થવાથી ખેતીમાં પેદાશ પુરતી નહિ રહેવાથી આપણી જ્ઞાતિનાં અમો કેટલાક ભાઇઓ પરદેશમાં વસીએ છીએ; જ્યાં અમો રહીએ છીએ ત્યાં બીજી ઉચ જ્ઞાતિના માણસો પણ રહે છે, તેઓ આપણા રીત રીવાજો કે જે આપણા કેટલાક ભાઇઓ મુડદાને દાટીએ છીએ તેના પાછળ ત્રીજે દીવસે જારતની ક્રિયા કરીએ તથા ત્રીયું (ત્રજા દીવસે જમણ) પણ કરીએ છીએ, વળી તેની પાછળ દેવ વીગેર કરીએ છીએ તે જોઇને અમોને બહુ શરમાવે છે પણ અમો સતપથનો તથા નાતનો કાયદો લોપી શકતા નથી. તેથી સતપંથના રીત રીવાજો શામાટે કરવામાં આવે છે તેના ખુલાસા માટે સૈયદ બાવા સાહેબ અહેમદઅલીને મુખી કાનજી વિરજીના નામથી પચાસ પ્રશ્નોની એક ચોપડી છપાવીને પુછ્યા તેનો જવાબ અમોને સૈયદ બાવા સાહેબે એક કાગળીઆ છપાવીનેજ પતાવી દીધો છે. જે તમારી પાસે પણ આવ્યો હશે ને તમો વાંચ્યો હશે ન વાંચ્યો હોય તો તમો જરૂરથી વાંચી જોશો તો તમોને પણ ખાત્રી થશે કે તેણે જવાબો લખવામાં કેટલો પોતાનો દમ દેખાડ્યો છે, પોતે વિદ્વાન છે તેથી આપણને અભણ અને ભોટ માની ન્યાયદર્શન તથા મનુસ્મૃતીના અધુરા શ્લોકો લખી પોતે ઋષિઓ અને મલેચ્છો બધાએના લક્ષણ એક સરખાં હોવા જોઇએ તેવુ બતાવી પોતાની વિદ્યાની કીમત કરાવી છે. વળી તે આગળ જતાં જે લખે છે તેનો મુળ ઉદેશ એજ છે કે, જ્યાંસુધી તમો હિન્દુ અને મુસલમાનનુ જુદાપણું જાણશો ત્યાંસુધી તમોને સતપંથ સમજવામાં નહિ આવે તેથી તમારે ને મારે ખાલી માથાકુટ કરવી નકામી છે.

પૂજ્ય વડીલો આવો જવાબ આપી સૈયદ બાવા સાહેબે તો ખરેખર અમો સતપંથીઓની હાંસીજ કરી છે પોતે વિદ્વાન છે તેમ પોતે પીરાણાના પીર ઇમામશાહની ઓલાદના હોવાનો દાવો કરે છે પણ અમોને 'તો આ કાગળીઆથી બીલકુલ તેની છળ પ્રપંચની નીતીજ દેખાય છે કારણ કે જુઓ ઇમામશાહના વંશના થઇને કેટલું ગોળમટોળ ન હિન્દુ કે ન મુસલમાન જેવું વર્તન કરી રહ્યા છે. પણ ઇમામશાહના વંશના તો સૈયદ પુંજામીયાં હુસેનમીયાં છે કે જે સત્યવક્તા નીડર અને બાહોસ વેપારી તરીકે પંકાય છે. તેમને જરાપણ પોતાના મતલબની પરવાહજ નથી પીરાણા સતપંથ હિન્દુ ધર્મ છે એવું ગુજરાતમાંથી ગામ માનકુવાના પટેલ લધા ખેતાએ એક હેન્ડબીલ તા. ૧-૨-૩૫ના રોજ છપાવીને સતપંથીઓને ભુલાવવાની કોશીશ કરી છે તેના જવાબમાં તા. ૨૪-૪-૩૫નાં રોજ એક ચોપાનીયું જે ફુલેશકેપ સાઇઝના ચાર પાના ભરીને છપાવ્યું છે તે ઘણુંજ લાંબુ અને ખુલાસાવાર છે પણ આ પત્રના લંબાણની બીકથી તેમાંથી ફક્ત એકજ પારેગ્રાફમાં જે મુદ્દાનું લખાણ છે તે આપ ભાઇઓની જાણ માટે અત્રે ઉતારવામાં આવ્યું છે. (વધારે જાણવું હોય તો પીરાણાના સૈયદ પુંજામીયાં પાસેથી મંગાવીને વાંચી જોશો) તે સાંભળો—

પાના બીજાની લીંટી-લાઇન ૨૯થી લખે છે કે :—

પીરાણાની દરગાહ અને તેના કમ્પાઉન્ડમાં **કબ્રસ્થાન છે મોટી મસજીદો છે, ઇમામખાનું છે તેમ બીજી દરગાહો છે. તે શીવાય કોઇબી હીંદુધર્મનું મંદીર કે હીંદુઓનું કોઈ સ્થાન કે મુરતીઓ નથી.** તે બધી દુનીયા આગળ મોજુદ છે પરન્તુ જે મુકરેલા છે તે ગમે તેમ કહે તેમાં કાંઈ વળે તેમ નથી વધારેમાં

જો તમો સાચા હો તો હિન્દુસ્તાનમાં જે વખણાતા પંડીતો હોય તેમને બોલાવી અમદાવાદ અગર બીજે ઠેકાણે એક સભા કરીને હિન્દુ ધર્મ છે તેવું સાબીત કરી આપો તો તમને રૂ૦ ૫૦૦૧) રૂપીઆ પાંચ હજારને એકનું ઈનામ આપવામાં આવશે. જો તમો જાહેર ખબર છપાવનારા સાચા હશો તો તેમ કરવા ચુકશો તો તમે જુઠા ને તમારૂં પ્રપંચપણું સાબીત છે.

ઉપરના લખાણથી આપ જ્ઞાતિ વડીલોને વિચારવું જોઇએ કે તમો માંયલા કેટલાક ભગતના ઉપનામથી ઓળખાતા ભાઇઓ અમોને હમેશાં કહેતા ફરો છો કે અમો વિદ્વાન છીએ, ચારવેદને જાણીએ છીએ ગમે તેવા પંડીતો હોય તે અમારી પાસે આવે તોપણ આ પીરાણા સતપંથ હિન્દુ ધર્મ છે એવું અમો સાબીત કરી આપવા તઇયાર છીએ તો ભાઇઓ તમો મહેરબાની કરીને એવા વિદ્વાન ભાઇઓને સમજાવી સૈયદ પુંજામીયાં પાસે તેડી જઇ પીરાણા સતપંથ હિન્દુ ધર્મ છે એવું સાબીત કરાવી રૂપીઆ ૫૦૦૧) નું ઇનામ લઇને જાહેર જનતામાં છપાવી બહાર પાડશો કે જેથી અમો પરદેશ વસતા ભાઇઓને બીજી હિન્દુ જ્ઞાતિઓના મહેણાં ટોણાં ખાવા પડે છે તેથી બચીએ.

ભાઇઓ! હમણાંજ અમોને ગુજરાતમાંથી એક આપણી જ્ઞાતિના હિતચિંતક બન્ધુ તરફથી એક ચોપાનીયું મળ્યું છે જે તા. ૧૫-૧૧-૩૬ મહાલક્ષ્મી પ્રીન્ટરી કપડવંજમાં છપાવેલ છે તેમાં તેણે પીરાણા સતપંથના સંબંધમાં આપણને જાણવા જેવું ગણુંજ સારૂ લખાણ કરેલું છે અને પીરાણાની ક્રિયાઓ અને પીરાણાની પૂજામાં વપરાતી પાવળની ગોળી કઇ કઇ ચીજમાંથી બનાવવામાં આવે છે તે તથા બીજી ગણી ઉપયોગી બાબતોનો ખુલાસો કરેલો છે તે આપણા પીરાણા સતપંથી સર્વે ભાઇઓએ જરૂરથી વાંચવા જેવો છે તે મંગાવીને વાંચવાથી આપશ્રીઓને ચોખ્ખું દેખાશે કે આપણા સતપંથી ભાઇઓમાંથી કેટલાક ભાઇઓ રમજાન મહીનાના ત્રીસે ત્રીસ રોજા રાખે છે તેમજ મહોરમના દીવસે પણ જરૂર જેવી ક્રિયાઓ કરે છે અને આપણે બધા મુડદાંને દાટીએ છીએ તેની ત્રીજે દીવસે જારત તથા ત્રીયાનું જમણ પણ કરીએ તેના દેવ વીગેરે કરીએ છીએ સવાર સાંજે દોવાઓ જે બોલીએ છીએ તે પણ મુસલમાની રીત મુજબ કલમાઓવાળી હોય છે અને તેજ દુવાઓથી આપણા છોકરા છોકરીઓને પરણાવીએ છીએ વીગેરે બાબતો આપણે મુસલમાની રીતેજ કરીએ છીએ ને વળી આપણું કુળ અને જ્ઞાતિનું ભુષણ તપાસતાં કેટલાક ભાઇઓ હિન્દુઓના દરેક દેવ મંદિરમાં જાય છે શ્રાવણ મહીનામાં શ્રીકૃષ્ણની જન્માષ્ટમી તથા દીવાળી હોળી વીગેરે તહેવારો પણ પાળીએ છીએ તેથી હવે અમોને વિચાર થાય છે કે આપણે કચ્છના કણબી પીરાણા સતપંથીઓ છીએ. કોણ હિન્દુ કે મુસલમાન ?

આ ઉપરની હકીકત વાંચી સાંભળીને આપ જરૂર વિચાર કરશો અને અમારી ઇચ્છા પીરાણા ધર્મ હિન્દુ ધર્મ છે કે મુસલમાની પંથ છે તેનો ખુલાસો કરશો તે કરવામાં જો ઢીલ થશે તો હવે અમો પરદેશમાં વસતા ભાઇઓને તમામ અરચણ વધશે, આપ ભાઇઓ જરૂરથી જલદીથી ખુલાસો કરશો. પ્રભુ તેમ કરવાની તમોને હિમત અને બુદ્ધિ આપે કે જેથી જ્ઞાતિમાં સંપ અને સલાહ થાય. એજ ઇચ્છતા અમો છીએ,

ઠેકાણુ :—પટેલ ખેતશી પ્રેમજી
વોરા ઇબ્રામજી સુલેમાનજી કંમપાઉન્ડ નાં. ૪
રણછોડ લાઇન, નબીબક્ષ રોડ-કરાચી.
કરાચી, તા. ૨૧-૧૨-૩૬

તમારાજ

realpatidar.com

જ્ઞાતિ બંધુઓ.

દુર્ગા પ્રીન્ટીંગ પ્રેસ-કરાચી.

3rd day after death, "Jarat" rituals are performed

Questions asked about such rituals to Khaki

Sholkas are quoted out of context

Muslims = Hindus

Extract of pamphlet published by Sayed Punjamiya Hussainmiya dated 24-Apr-1935

KKP observing Ramzan and Muharram